



# Freedom Valley School, Bardoli

(ACADEMIC SESSION-2024-25)

PERIODIC TEST- III

SYLLABUS,PAPER PATTERN,DATE-SHEET

CLASS-VII

Dear Parents,

Dear Parents,

Greeting from Freedom Valley School,

**Learning is a gift:** "The beautiful thing about learning is that no one can take it away from you."

Kindly note down, that as per the school calendar, **Periodic Test-III for Std. 6 to 9** is to start on **21.12.2024**. We know you are all really anxious for your child to do well. We extend our hand to encourage your Child to work hard. Please go through the Exam details carefully.

SN.	SUBJECT & EXAM DATE	CHAPTERS/TOPICS	PAPER PATTERN
1.	Computer 21.12.2024 (Saturday)	Ch-6 Review Python Ch-8 Internet Services	Q-1 Fill in the blanks. [05] Q-2 State True or False. [05] Q-3 Multiple-choice questions. [05] Q-4 Answer the following questions. (Any 5) [10] <b>Total Marks: 25</b>
2.	Social Science 23.12.2024 (Monday)	<b>History</b> Ch.4 The Mughals 16 <sup>th</sup> to 17 <sup>th</sup> Century Ch.5 Tribes, Nomads and Settled Communities <b>Geography:</b> Ch.4 Air Ch.5 Water <b>Civics:</b> Ch.4 Growing up as Boys and Girls Ch. 5 Women Change the World	<b>Section-A</b> Q:1 Multiple-choice questions. [12] <b>Section-B</b> Q:2 Very Short answer type Questions(any-5) [10] <b>Section-C</b> Q:3 Short answer type Questions (any-3) [09] <b>Section-D</b> Q:4 Long answer type questions (any-2) [10] <b>Section-E</b> Q:5 Case Study [04] <b>Section- F</b> Q:6 Map Work [05] <b>Total Marks: 50</b>
3.	Gujarati 24.12.2024 (Tuesday)	પાઠ:૧૦ કાલિદાસ પાઠ:૧૧ હરિને ભજતાં હજી કોઈની લાજ પાઠ:૧૨ શકુર સરોવર	<b>વિભાગ અ</b> પ્ર:૧ અપઠિત ગદ્યાંશ પ્રશ્નોત્તર (5 M) પ્ર:૨ (અ) વ્યાકરણ (10M) સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, જોડણી

		<p>પાઠ:૧૩ બીરબલની સલાહ</p> <p>પાઠ:૧૪ નાટક જીવનનું અંગ બનવું</p>	<p>સુધારો, વાક્યપ્રયોગ,સંજ્ઞા અને તેના પ્રકારો, વાક્ય નો અર્થ સ્પષ્ટ કરો ,શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્ય પ્રયોગ</p> <p>પ્ર:૩ (અ) ખાલી જગ્યા પૂરો (5 M )</p> <p>(બ) કોણ બોલે છે ને કોને કહે છે તે લખો.(3M )</p> <p>(ક) ખરા ખોટા જણાવો (2M)</p> <p><b>વિભાગ - બ</b></p> <p>પ્ર: ૪(અ) પઠિત પદ્યાંશ (5 M)</p> <p>(બ) એક એક વાક્યમાં જવાબ લખો. (3 M)</p> <p>(ક) બે ત્રણ વાક્યમાં જવાબ લખો (4 M)</p> <p>(ડ) વિસ્તારથી પ્રશ્નોના જવાબ (3 M)</p> <p>પ્ર:૫ લેખન વિભાગ</p> <p>નિબંધ લેખન અને વાર્તાલેખન (10M)</p> <p style="text-align: right;"><b>Total Marks: 50</b></p>
4.	<p>Sanskrit</p> <p>24.12.2024</p> <p>(Tuesday)</p>	<p>પાઠ:-9 અહમપિ વિદ્યાલયં ગમિષ્યામિ</p> <p>પાઠ:-10 વિશ્વવધુત્વમ્</p> <p>પાઠ:-11 સમવાયો હિ દુર્જન:</p>	<p>ખણ્ડ-ક અપઠિત અવબોધનમ્ (05 અંક)</p> <p>અપઠિત ગદ્યાંશ</p> <p>ખણ્ડ-ખ રચનાત્મકકાર્યમ્ (10 અંક)</p> <p>ચિત્રવર્ણનમ્, પત્ર, વાક્યભાષાન્તર</p> <p>ખણ્ડ-ગ વ્યાકરણમ્ (19 અંક)</p> <p>સંધિ, પ્રત્યય, શબ્દરૂપ, ધાતુરૂપ, ઉપપદવિભક્તિ, સંખ્યા, ઉપસર્ગ</p> <p>ખણ્ડ-ઘ પઠિત અવબોધનમ્ (16 અંક)</p> <p>પઠિત ગદ્યાંશ, પદ્યાંશ, પ્રશ્નનિર્માણ, મિલાન</p> <p style="text-align: right;"><b>Total Marks: 50</b></p>
5.	<p>English</p> <p>26.12.2024</p> <p>(Thursday)</p>	<p><b>Book-1</b></p> <p>Ch.5 Quality, Trees</p> <p>Ch.6 Expert Detective, Mystery of talking Fan</p> <p><b>Book-2</b></p> <p>Ch.5 The Bear Story</p> <p>Ch.6 A Tiger in the House</p> <p><b>Grammar:</b> Preposition, Conjunctions, Reported speech, Subject-Verb-Agreement.</p> <p><b>Writing Skill:</b> Formal letter, Story, Paragraph</p>	<p><b>Section: A</b></p> <p>Q:1 Unseen Passage [08]</p> <p>Q:2 Unseen Passage [06]</p> <p><b>Section: B</b></p> <p>Q:3 Writing Skill [04]</p> <p>Q:4 Writing Skill [04]</p> <p>Q:5 Grammar [04]</p> <p><b>Section: C</b></p> <p>Q:6 Seen Passage, objectives, answer in one sentence [08]</p> <p>Q:7 Short answer [2m] [08]</p> <p>Q:8 Long answer [4m] [08]</p> <p style="text-align: right;"><b>Total Marks: 50</b></p>

6.	Science 27.12.2024 (Friday)	Lesson-8 Reproduction in plants  Lesson-9 Motion and time  Lesson-10 Electric current and its effects	<b>Section-I</b> (A) Select the correct option 1 M × 10 Q (10) (B) Answer in one sentence 1 M × 10 Q (10) <b>Section-II</b> (C) Ans. In very short 2 M × 3 Q (06) (D) Ans. In short 3 M × 4 Q (12) (E) Ans. In detail 4 M × 3 Q (12)  <b>Total Marks: 50</b>
7.	Mathematics 30.12.2024 (Monday)	Ch-8 Rational Numbers Ch-9 Perimeter and Area Ch-10 Algebraic Expressions	<b>Section – A</b> ( 12 MCQ X 1 mark = 12 marks) <b>Section – B</b> (5 Questions X 2 marks = 10 marks) <b>Section – C</b> ( 4 Questions X3 marks =12 marks) <b>Section – D</b> (4 Questions X 4 marks =16 marks) <b>Total Marks: 50</b>
8.	Hindi 31.12.2024 (Tuesday)	पाठ- 9 एक तिनका पाठ- 10 खान पान की बदलती तसवीर पाठ- 11 नीलकंठ पाठ- 12 भोर और बरखा	<b>खंड ( क) दो अपठित गद्यांश = 8 अंक</b> एक अंकीय चार बहुविकल्पीय प्रश्न (1 x 4) लघुत्तरात्मक प्रश्न (1x2 ) <b>खंड – ख व्यावहारिक व्याकरण = 8 अंक</b> अतिलघु/ लघुत्तरात्मक (पर्यायवाची और विलोम शब्द, उपसर्ग, प्रत्यय, संधि-विच्छेद, श्रुतिसमभिन्नार्थक शब्द, वाक्यांश के लिए एक शब्द,) <b>खंड- (ग) पाठ्यपुस्तक = 24 अंक</b> एकपठित गद्यांश एक अंकीय बहुविकल्पीय प्रश्न –5 एक पठित पद्यांश एक अंकीय बहुविकल्पीय प्रश्न –5 दो प्रश्न (20 -25 शब्दों में) 2 x 2 = 4 अंक दो प्रश्न ( 30 -40 शब्दों में) 3 x 2 = 6 अंक एक प्रश्न- (40-50 शब्दों में) 4 x 1 = 4 अंक <b>खंड – घ लेखन विभाग = 10 अंक</b> अनुच्छेद लेखन = 4 अंक पत्र / विज्ञापन लेखन = 3 अंक चित्र वर्णन = 3 अंक  <b>Total Marks: 50</b>

Principal  
Freedom Valley School